



બં. અ. કૃષિ મહાવિદ્યાલય  
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮ ૧૧૦



તા ૨૨-૦૨-૨૦૨૩

## પ્રેરણાદાયી વ્યાખ્યાનનું બં. અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ બં. અ. કૃષિ મહાવિદ્યાલયમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કૃષિના અભ્યાસક્રમની સાથે વિવિધ રમતગમતો, સાંસ્કૃતિક તેમજ વ્યક્તિગત વિકાસના જેવા કે આધ્યાત્મિક, યોગ પ્રાણાયમ કાર્યક્રમો અવારનવાર યોજવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવતા મહાનુભાવો અત્રે પધારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે. આવાજ કાર્યક્રમના ભાગરૂપે અત્રેના કૃષિ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓના ઉત્તરકર્ષ માટે એક મોટીવેશન લેક્ચર તા ૨૨-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે ૫.૦૦ થી ૬.૧૫ કલાકે અત્રેના એકઝામ હોલ ખાતે આયોજન કરવામાં આવેલ જે માટે અર્કા ફાઉન્ડેશનના ફાઉન્ડર, શ્રીનિવાસ અર્કા કે. Philosopher અને International Speaker દ્વારા Stress Management અને self tolerance વિષય ઉપર "**How to Focus Better & Create Stress free Learning**" નું વ્યાખ્યાયન આપેલ. આ કાર્યક્રમ માં અંદાજે ૪૦૦ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ જેમાં બં. અ. કૃષિ મહાવિદ્યાલયમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોલેજો ના વિદ્યાર્થીઓ ભાગ લીધેલ. કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી, ડૉ. વાય. એમ. શુક્લ તેમજ વિદ્યાર્થી પરિષદના સભ્યઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં આચાર્યશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન કરી સહુને આલ્કાર્યા હતા અને વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓ પણ સાહિત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે તે માટે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રેયા સટપટે (LR), રાજ પટેલ, પ્રિયા યાદવ, હેત પટેલ અને તેમની ટીમે ડો. ડી. જી. પરમાર, ચેરમેન એસઆરસી બીએસીએના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



